



**M. B. PARIKH
FINSTOCKS
LIMITED**

Regd Office : 705, Galav Chambers, Sayajiganj,
Vadodara - 390 005. Tel. (0265) 236 2909

CIN No. : L65910GJ1994PLC021759

Date: 01st February, 2020

To,
The Deputy Manager,
Department of Corporate Services,
BSE Limited
P. J. Towers, Dalal Street,
Mumbai - 400 001
Fax: 022-2679 0463

Dear Sir,

Ref: BSE Scrip Code - 526935

Sub: Intimation regarding the Outcome of the Board Meeting.

Pursuant to sub regulation (4) of Regulation 30 read with Schedule III of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we have to inform you that the Meeting of the Board of Directors of the Company was held today; i.e. Saturday, 01st February, 2020 as scheduled at 12.30 p.m. and concluded at 2.10 P.M. and inter-alia transacted the following business:


1. Approved the Un-Audited Financial Results along with Limited Review Report for the third quarter and nine months ended 31st December, 2019, copy of the same is enclosed for your reference.

Kindly take the above on your record and oblige.

Thanking You.

Yours faithfully,

For M. B. Parikh Finstocks Limited



Monalisa Parikh
Managing Director
DIN: 00294485

Encl: As above (Un-Audited Financial Results along with Limited Review Report for the third quarter and nine months ended 31st December, 2019)

Corporate Off. : 9/10, Heena Arcade, 2nd Floor, S. V. Road, Jogeshwari (W), Mumbai - 400 102.
Tel. : (022) 2679 0434/2105 ● Fax : 26790463 ● E-mail : corporate@mbpfin.com

Business Standard
AHMEDABAD EDITION

Printed and Published by Himanshu S Patwa on behalf of Business Standard Private Limited and printed at M/S Bhaskar Printing Press, Survey No 148-P, Near Nagdeviya Mandir, Bavla Highway, Sanand Dist. Ahmedabad and published at Office No. 207, Sakar-II, Ashram Road, Ahmedabad-380006

Editor : Shyamal Majumdar

RNI NO. GUJENG/2001/4577

Readers should write their feedback at feedback@bsmail.in
Ph. 079-26577772, Fax: +91-79-26577728

For Subscription and Circulation enquiries please contact:
Ms. Mansi Singh
Head-Customer Relations
Business Standard Private Limited,
H/4 & V/3, Building H,Paragon Centre, Opp. Birla Centrium, P.B.Marg, Worli, Mumbai - 400013
E-mail: subs_bs@bsmail.in
"or sms, SUB BS to 57007"

DISCLAIMER News reports and feature articles in Business Standard seek to present an unbiased picture of developments in the markets, the corporate world and the government. Actual developments can turn out to be different owing to circumstances beyond Business Standard's control and knowledge. Business Standard does not take any responsibility for investment or business decisions taken by readers on the basis of reports and articles published in the newspaper. Readers are expected to form their own judgement.
Business Standard does not associate itself with or stand by the contents of any of the advertisements accepted in good faith and published by it. Any claim related to the advertisements should be directed to the advertisers concerned.
Unless explicitly stated otherwise, all rights reserved by M/s Business Standard Pvt. Ltd. Any printing, publication, reproduction, transmission or dissemination of the contents, in any form or by any means, is prohibited without the prior written consent of M/s Business Standard Pvt. Ltd. Any such prohibited and unauthorised act by any person/legal entity shall invite civil and criminal liabilities.

No Air Surcharge

GUJARAT FLUROCHEMICALS LIMITED
(Earlier known as Inox Fluorochemicals Limited)

Registered Office: Survey No.16/3, 26 & 27, Village Ranjitnagar - 389 380
Taluka : Ghoghamba, District : Panchmahal, Gujarat
CIN : L24304GJ2018PLC105479
Website : www.gfl.co.in; Email : bvdesai@gfl.co.in

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the Board of Directors of the Company is scheduled to meet on **Friday, 14th February, 2020**, inter-alia, to consider and approve the Unaudited Financial Results of the Company for the **quarter and nine months ended 31st December, 2019**. The above information is also available on the website of the Company www.gfl.co.in and BSE www.bseindia.com and NSE www.nseindia.com.

For Gujarat Fluorochemicals Limited
Sd/
BHAVIN DESAI
Company Secretary

Place : Vadodara
Date : 05thFebruary, 2020

Kavit Industries Limited
CIN: L23100GJ1990PLC014692
Regd. Off.: Tundav Anjesar Road, Village Tundav, Savli, Baroda, Gujarat, 391775. Tel: 0265-2362000;
Email: kavitindustriestlimited@gmail.com
Website: www.kavitindustries.in

NOTICE OF THE BOARD MEETING

Notice is hereby given pursuant to Regulation 29 read Regulation 47 of SEBI (LODR) Regulations, 2015 that the Meeting of the Board of Directors of Company will be held on **Thursday, 13th February, 2020**, inter-alia, to consider the Unaudited Financial Results (Standalone and Consolidated) for the Quarter ended December 31, 2019 and any other matter with the permission of the Chair.

The said notice may be accessed on the Company's website at www.kavitindustries.in and also on website of the Stock Exchange at www.bseindia.com including Unaudited Standalone and Consolidated Financial Results after approved by the Board.

For Kavit Industries Limited
Sd/-
Harish Punwani
Company Secretary
A50950

Date: 05/02/2020
Place: Baroda

KKALPANA INDUSTRIES (INDIA) LIMITED
CIN: L19202WB1985PLC039431
Regd Office: 2B, Pretoria Street, Kolkata - 700 071
Telephone: 91-033-2282 3744/3745/3699/3671, Fax: 91-033-2282 3739
E-Mail: kolkata@kikalpana.co.in
Website: www.kkalpanagroup.com

NOTICE

Notice is hereby given, pursuant to Regulation 47(1) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that (06th of 2019-20) meeting of the Board of Directors of Kkalpana Industries (India) Limited will be held on Friday, the 14th day of February, 2020 at 3:30P.M. at its Registered Office at 2B Pretoria Street, Kolkata-700 071, inter-alia, to consider and approve the Un-audited Financial Results (Standalone and Consolidated) of the company for the quarter and nine months ended 31st December, 2019, pursuant to Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. Further, the trading window of the Company for dealing in equity shares of the Company will remain closed for all directors, executives one level below the Board and designated employees with effect from 03rd January, 2020 to 16th February, 2020 (both days inclusive), pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 read with Code of Conduct to regulate, monitor and report trading by insiders formed by the Company. In accordance with Regulation 47(2) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the said notice may be accessed on the company's website at www.kkalpanagroup.com and can also be accessed at BSE's website at www.bseindia.com and CSE's website at www.cseindia.com

For Kkalpana Industries (India) Limited
Sd/-
Date: 04.02.2020. **Tanvi Panday**
(Membership No. ACS 31176)
Company Secretary

Surat Main Branch, Post Box No.226, Lal Gate, Kanpith, Surat - 395003.
Phone No.: 0261-2594141-44
E Mail : surat.vadodara@bankofindia.co.in

बैंक ऑफ़ इंडिया
Bank of India

(Rule 8(1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas The undersigned being the authorised officer of the Bank of India Surat Main Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest(Enforcement) Rules, 2002 issued a demand notice dated 05.11.2019 calling upon the borrower M/S D Raj Knit to repay the amount mentioned in the notice being **Rs. 96,60,247.32** (Rupees Ninety six lakhs sixty thousand two hundred forty seven and thirty two paise) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest(Enforcement) Rules, 2002 on this the **29th day of January of the year 2020**.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of India** Surat main branch for an amount **Rs. 96,60,247.32** and interest thereon

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of factory Land & Building situated at 143, Darshan Ind.Estate, Vill-Jolva, Tal-Palsana, Surat owned by M/S D Raj Knit (A partnership firm).

Bounded:
On the North by Internal Road
On the South by Adj. Plot No. 144
On the East by Entry & Internal Road
On the West by Adj. Plot NO. 142

All that part and parcel of the property situated at Residential Flat No B-1001, Sentosa Hights, Utran Mota, Varachha, Surat owned by Mr. Ashokbhai Premjibhai Navadiya & Mrs. Daxaben Ashokbhai Navadiya.

Bounded:
On the North by Internal Road, Garden & Building No. C
On the South by Passage & Flat No. 1004
On the East by Flat No. 1002
On the West by Internal Road & Building No. A

All that part and parcel of the property situated at Plot No 24 Surya Prakash Bunglow, Surat owned by Mrs. Manjulaben Ramjibhai Mavani.

Bounded:
On the North by Plot No.25
On the South by 6 mts. Wide Internal Road, Plot No. 21 & 22
On the East by Internal Road, Plot No. 13
On the West by Plot No.23

Date : 29.01.2020
Place : SURAT

D. V. Patankar
Chief Manager & Authorized Officer
Bank Of India, Surat Main Branch

सेंट्रल बैंक ऑफ़ इंडिया
Central Bank of India

METODA BRANCH, METODA - GIDC , RAJKOT (GUJARAT)
Tel: 02827-287685 PIN CODE-360 021

APPENDIX - IV [Rule - 8 (1)]

POSSESSION NOTICE (For Immovable property)

Whereas the undersigned being the authorized officer of the Central Bank of India, Metoda Branch, under the Secularization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 11-11-2019 and Publish in two newspapers on dated 27-11-2019 calling upon the borrower **Mr. Rajubhai Premjibhai Solanki (Borrower/ Mortgagee) and Mrs. Jayshreebhai Rajubhai Solanki (Co- Borrower/Mortgagee)** to repay the amount mentioned in the notice being **Rs. 8,92,057.00** (Rs. Eight Lakhs Ninety Two Thousand Fifty Seven only) plus interest w.e.f 11-11-2019, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 9 of the said rules on this **3rd day of February of the year 2020**.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, METODA Branch, for an amount **Rs. 8,42,057.00** (Rs. Eight Lakhs Forty Two Thousand Fifty Seven only) and interest thereon w.e.f. 11-11-2019 plus other charges. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has given effect)

Description of the Immovable Property

Equitable Mortgage of Property in the name Mr. Rajubhai Premjibhai Solanki and Mrs. Jayshreebhai Rajubhai Solanki.
Address of Property : Residential Flat No. 101 having built up area adm. Sq.mts. 52-20 situated on the first floor of the building known as "Siddhi Vinayak Complex" situated on the land adm. Sq.mts. 525-00 of Plot No. 1 to 4 of the area known as "Madhuvan Park - 2" of F.P. No. 66/1, T.P.S. No. 21 (Mavdi) of Revenue Survey No. 177 pakee of Village Mavdi, District Rajkot in the State of Gujarat.
Boundary of the said property are as under :-
North : Space of Margin thereafter other's property
South : Passage, Stair thereafter Flat No. 103
East : Space of Margin thereafter 7-50 Mts. Wide road.
West : Entrance of Flat , Lift & Flat No. 102

Date : 03-02-2020
Place : Metoda

-Authorised Officer

M B PARIKH FINSTOCKS LIMITED
Regd. Office: 705, Galav Chambers, Vadodara - 390005.
Corp. Office : 209/210, Heena Arcade, S.V. Road, Jogeshwari (W), Mumbai 400102.
CIN : L65910GJ1994PLC021759 Tel No. : (0265) 236 2909
Website : www.mbpfin.com, Email : corporate@mbpfin.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTH ENDED ON DECEMBER 31, 2019

| Sr. No. | Particulars | Quarter ended | | Nine months ended | | Year Ended | |
|---------|--|---------------------------|---------------------------|---------------------------|---------------------------|-------------------------|----------------|
| | | 31.12.2019 (Unaudited) | 30.09.2019 (Unaudited) | 31.12.2018 (Unaudited) | 31.12.2019 (Unaudited) | 31.03.2019 (Audited) | 31.03.2019 |
| 1 | Total Income from Operations | 41.59 | 11.12 | 9.96 | 59.287426 | 26.96 | 43.52 |
| 2 | Net Profit / (Loss) for the period before Tax | 33.80 | 2.95 | 1.11 | 32.38 | -7.12 | -0.35 |
| 3 | Net Profit / (Loss) for the period after Tax | 33.80 | 3.71 | 1.24 | 33.14 | -6.60 | -17.60 |
| 4 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 33.80 | 3.71 | 1.24 | 33.14 | -6.60 | -15.87 |
| 5 | Equity Share Capital | 300.00 | 300.00 | 300.00 | 300.00 | 300.00 | 300.00 |
| 6 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | | | | | | |
| 7 | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic Rs. (b) Diluted Rs. | 1.13 1.13 | 0.12 0.12 | 0.04 0.04 | 1.10 1.10 | -0.22 -0.22 | -0.53 -0.53 |

NOTE : 1. The above is an extract of the detailed format of Quarterly unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. For and on behalf of the Board of Directors of M B Parikh Finstocks Ltd
Date : 01st February, 2020
Place : Mumbai
Monalisa Digant Parikh - Chairperson / Managing Director
DIN 00294485

V MART
PRICE "LESS" FASHION

Extract of Unaudited Financial Results for the Quarter and Nine months ended 31 December 2019

| S. No. | Particulars | Quarter ended | | Nine Months ended | | Year ended | |
|--------|--|---------------------------|---------------------------|---------------------------|---------------------------|-------------------------|----------------|
| | | 31.12.2019 (Unaudited) | 30.09.2019 (Unaudited) | 31.12.2018 (Unaudited) | 31.12.2019 (Unaudited) | 31.03.2019 (Audited) | 31.03.2019 |
| 1 | Total Income | 56,258.95 | 31,533.58 | 46,755.42 | 1,33,305.49 | 1,09,288.07 | 1,43,966.78 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 7,697.36 | (2,287.72) | 6,702.48 | 7,998.00 | 9,715.55 | 10,961.04 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 7,697.36 | (2,287.72) | 6,702.48 | 7,998.00 | 9,470.55 | 9,981.10 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 5,822.11 | (1,804.14) | 4,168.41 | 5,778.03 | 6,252.64 | 6,162.62 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 5,817.06 | (1,823.31) | 4,171.90 | 5,748.18 | 6,289.47 | 6,126.95 |
| 6 | Paid up equity share capital (face value of ₹10 per share each) | 1,815.55 | 1,815.36 | 1,812.72 | 1,815.55 | 1,812.72 | 1,813.00 |
| 7 | Other equity | | | | | | 39,114.04 |
| 8 | Earnings Per Share (of ₹10/- each) (not annualized) - (a) Basic (b) Diluted | 32.07 32.03 | (9.94) (9.94) | 23.00 22.99 | 31.83 31.80 | 34.50 34.39 | 34.01 33.90 |

The above is an extract of the detailed format of quarterly financial results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly financial results is available on the Stock Exchanges websites - www.nseindia.com/www.bseindia.com and on the Company's Website - www.vmart.com

The financial results have been prepared in accordance with the Indian Accounting Standards ('Ind-AS') as notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as specified in section 133 of the Companies Act, 2013.

The said financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in its meeting held on 05 February, 2020

For and on behalf of the Board of Directors of
Sd/-
Lalit Agarwal
Chairman & Managing Director
DIN: 00909090

Place: Gurugram
Date: 05 February, 2020

V-MART RETAIL LIMITED
Regd. Off. - 610-611, Guru Ram Dass Nagar, Main Market, Opp. SBI Bank, Laxmi Nagar, New Delhi - 110092.
Corporate Off. - Plot No. 862, Udyog Vihar, Industrial Area, Phase - V, Gurugram - 122016
Tel. : 0124-4640030; Fax : 0124-4640046; Email : info@vmart.co.in;
Website: www.vmart.co.in, CIN - L51909DL2002PLC163727

BERGER PAINTS INDIA LIMITED
[CIN : L51434WB1923PLC004793]
Registered Office: Berger House, 129 Park Street, Kolkata - 700017
Phone: 033 2249 9724-28 • Fax: 033 2227 7288
Email: consumerfeedback@bergerindia.com • Website : www.bergerpaints.com

EXTRACT OF THE CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2019 (₹ Crores)

| Sr. No. | Particulars | Three Months Ended | Three Months Ended | Nine Months Ended | Nine Months Ended |
|---------|--|---------------------------|---------------------------|---------------------------|---------------------------|
| | | 31.12.2019 (Unaudited) | 31.12.2018 (Unaudited) | 31.12.2019 (Unaudited) | 31.12.2018 (Unaudited) |
| 1 | Total income from operations | 1,695.87 | 1,616.70 | 5,010.98 | 4,589.77 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) | 249.61 | 203.67 | 729.78 | 583.75 |
| 3 | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items) | 249.61 | 203.67 | 729.78 | 583.75 |
| 4 | Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items) | 181.85 | 133.18 | 522.92 | 383.52 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 176.73 | 102.90 | 542.11 | 375.34 |
| 6 | Equity Share Capital [Face Value Re 1/-] | 97.12 | 97.10 | 97.12 | 97.10 |
| 7 | Earnings Per Share (of Re 1/- each) (not annualised)* Basic: (amount in INR) Diluted: (amount in INR) | 1.91 1.91 | 1.38 1.38 | 5.75 5.75 | 3.98 3.98 |

* (Rounded off upto two decimal figures)

Notes :

- The above results, as reviewed by the Audit Committee, were approved and taken on record by the Board of Directors at its meeting held on 5th February, 2020. These results have been subjected to "Limited Review" by statutory auditors of the Company.
- The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015. The full format of the quarterly Unaudited Financial Results are available on the websites of Stock Exchanges at <http://www.nseindia.com> and <http://www.bseindia.com> and also on the Company's website at <http://www.bergerpaints.com>.

For and on behalf of the Board of Directors
ABHIJIT ROY
Managing Director & CEO
DIN : 03439064

Place : New Delhi
Dated : 5th February, 2020

No Daag No Dhabba
Aur Active Filter se
Fresh Smell

Berger
EASY CLEAN
Fresh
Luxury Interior Emulsion

Now with ACTIVE FRESHNESS
Cross Linking Polymers
Effortless cleaning

www.bergerpaints.com

MANGALAM CEMENT LIMITED
 CIN: L26943RJ1976PLC001705
 Regd. Office: P.O. Aditya Nagar - 385520
 Morak, Distt. Kota (Rajasthan)
 Email: shares@mangalamcement.com
 Tel: +91-7459-231327, Fax: +91-7459-232036

NOTICE

NOTICE is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 that a meeting of the Board of the Directors of the Company will be held on Friday, the 14th February, 2020, at Kolkata, inter alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the Quarter & Nine months ended 31st December, 2019. The said information is also available on the Company's website at www.mangalamcement.com and may also be available on the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com.

For Mangalam Cement Limited
 Manoj Kumar
 Date: 5th February, 2020 GM (Legal & Company Secretary)

એમ્બેસેડર ઇન્ડીયા લોહીયો સીમીન્ટ લિમિટેડ
 CIN: L17119GJ1982PLC009258
 રજીસ્ટર્ડ ઓફિસ : ૧૦૮૩/૧, ૩૦૫, સુર માઉન્ટ કોમ્પ્લેક્સ, ઇન્ડિયા સીટી, અમદાવાદ, ગુજરાત, ભારત.
 એસ.જી. ઇલેક્ટ્રોનિક્સ, સેલેબાદ, અમદાવાદ, રાજ્ય.

નોટીસ

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બુધવાર, ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ૧૦૮૩/૧, ૩૦૫, સુર માઉન્ટ કોમ્પ્લેક્સ, ઇન્ડિયા સીટી, અમદાવાદ, ગુજરાત, ભારત, અમદાવાદ - ૩૮૦૦૦૬, ગુજરાત ખાતે અથવા બાબતોની ૩૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પુરા થતાં વિશ્વાસિક ગણના કંપનીનાં અનઓડિટેડ નાણાકીય પરિણામો અને મર્યાદિત સમાલોચના રીપોર્ટ અને રેવેન્યુની સમીક્ષા કરવા અથવા બાબતોની વિચારણા અને સ્વીકૃતિ માટે યોજાશે.

વધુ વિગતો માટે કંપનીની વેબસાઇટ વેબ સિટિ www.ambassadorindia.com અને <https://www.bseindia.com/corporates/ann.html?scpr=542524> પર મુલાકાત લેવાઈ શકે છે.

એમ્બેસેડર ઇન્ડીયા લોહીયો સીમીન્ટ લિમિટેડ વતી સહી/-
 તારીખ: ૦૬.૦૨.૨૦૨૦ સિદ્ધાંત અમદાવાદ
 સ્થાન: અમદાવાદ મેનેજિંગ ડિરેક્ટર

EITA INDIA LIMITED
 (FORMERLY: E.I.T.A India Limited)
 CIN: L51109WB1983PLC035969
 Regd. Office: 20-B, Abdul Hamid Street, 4th Floor, Kolkata-700 069,
 Phone: 033-22483203
 E-mail: eita.cal@eitain.com
 Website: www.eitain.com

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 meeting of the Board of Directors of the Company will be held at its Registered office at 20B Abdul Hamid Street, 4th Floor, Kolkata-700069 on Friday 14th February, 2020 at 1.00 P.M., inter alia to consider and take on record the Unaudited Financial Results of the Company for the quarter ended December 31, 2019.

By Order of the Board
 For EITA India Limited
 Place: Kolkata Company Secretary
 Date: 05.02.2020 Sd/-
 Place: Kolkata

The Notice is also available on the Company's website at www.eitain.com and on the Stock Exchange website at www.cse-india.com.

ફોર્મ નં. યુઆરસી - ૨
 (કંપની કાયદા ૨૦૧૩ ની કલમ ૩૭૪ (બી) અને કંપની (ઓથોરાઇઝ્ડ ટુ રજીસ્ટર) નિયમો ૨૦૧૪ ના નિયમ ૪ (૧)) અન્વયે રેપોર્ટ ૨૧ ના વિભાગ ૧ હેઠળ રજીસ્ટ્રેશન અંગે નોટીસ આપતી જાહેરાત

૧. કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૩૬૬(૧) અને કંપની (ઓથોરાઇઝ્ડ ટુ રજીસ્ટર) નિયમો ૨૦૧૪ ના નિયમ ૪ (૧) અન્વયે રેપોર્ટ ૨૧ ના વિભાગ ૧ હેઠળ રજીસ્ટ્રેશન અંગે નોટીસ આપતી જાહેરાત

૨. કંપનીનાં મુખ્ય હેતુઓ નીચે મુજબ છે: ખાદ્ય ચીજો, બીજ, છોડ, ફલો, શાકભાજી, ફળો, ખાદ્યતેલ, નરુસ, મસાલા, આવશ્યક તેલો, લાકડા, અન્ય કોઇ ખાદ્ય, ખાદ્ય સંબંધિત ચીજો અથવા તમામ પ્રકારના ઓર્ગેનિક અને બિન ઓર્ગેનિક રસાયણો, કોષ્ટકપૂર્ણ પ્રકારના ખાતર, સુકમ ખાતર, ઉત્પાદક, ઉત્પાદન, પ્રક્રિયા, ખરીદ, વેચાણ, અપવાદ, નિકાસ, માર્કેટીંગ, પ્રમોશન, પિક, પેકીંગ, શીપીંગ અને ડિલીવરી તરીકેની કામગીરી કરવી અને અને ખેતીલાયક ઉપકરણો અને અન્ય પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.

૩. દરખાસ્ત કરાયેલ કંપનીનાં ગ્રાહક મેમ્બરેટ્સ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ સર્વે નં. ૧૦૩, જેતલપુર પાસે, સહકારી પેટ્રોલ પંપ સામે, જેતલપુર-આરજી રોડ, અમદાવાદ ૩૮૨૪૨૫, ગુજરાત ખાતે જોઇ શકાશે.

૪. આ સાથે અહીં નોટીસ આપવામાં આવે છે કે આ અરજીનો વિરોધ કરવા માંગતી કોઇપણ વ્યક્તિ તેમનાં વાંધાઓ રજીસ્ટ્રારને લેખીતમાં મેન્ટલ રજીસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી), ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ), પ્લોટ નં. ૬, ૭, ૮, સેક્ટર-૫, આઇએમટી માનેસર, જિલ્લો ગુડામ, (હરિયાણા), પિનકોડ - ૧૨૨૦૫૦ ને આ નોટીસનાં પ્રકાશનની તારીખથી ૨૧ દિવસની અંદર કંપનીને તેની રજીસ્ટર્ડ ઓફિસ ખાતે નકલ સહિત મોકલી શકે છે.

તારીખ : ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૦

અરજદારનાં નામ
 ૧. હસમુખભાઇ દવે
 ૨. જીએસ શાહ

M B PARIKH FINSTOCKS LIMITED
 Regd. Office: 705, Galav Chambers, Vadodra - 390005.
 Corp. Office : 209 / 210, Heena Arcade, S.V. Road, Jogeshwari (W), Mumbai 400102.
 CIN : L65910GJ1994PLC021759 Tel No.: (0265) 236 2909
 Website : www.mbpfin.com, Email : corporate@mbpfin.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTHS ENDED ON DECEMBER 31, 2019

| Sr. No. | Particulars | Quarter ended | | | Nine months ended | | | Year Ended | | |
|---------|--|---------------------------|---------------------------|---------------------------|---------------------------|---------------------------|-------------------------|------------|--|--|
| | | 31.12.2019 (Unaudited) | 30.09.2019 (Unaudited) | 31.12.2018 (Unaudited) | 31.12.2019 (Unaudited) | 31.12.2018 (Unaudited) | 31.03.2019 (Audited) | | | |
| 1 | Total Income from Operations | 41.59 | 11.12 | 9.96 | 59.2874246 | 26.96 | 43.52 | | | |
| 2 | Net Profit / (Loss) for the period before Tax | 33.80 | 2.95 | 1.11 | 32.38 | -7.12 | -0.35 | | | |
| 3 | Net Profit / (Loss) for the period after Tax | 33.80 | 3.71 | 1.24 | 33.14 | -6.60 | -17.60 | | | |
| 4 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 33.80 | 3.71 | 1.24 | 33.14 | -6.60 | -15.87 | | | |
| 5 | Equity Share Capital | 300.00 | 300.00 | 300.00 | 300.00 | 300.00 | 300.00 | | | |
| 6 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | | | | | | | | | |
| 7 | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic Rs. (b) Diluted Rs. | 1.13 1.13 | 0.12 0.12 | 0.04 0.04 | 1.10 1.10 | -0.22 -0.22 | -0.53 -0.53 | | | |

NOTE : 1. The above is an extract of the detailed format of Quarterly unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. For and on behalf of the Board of Directors of M B Parikh Finstocks Ltd
 Date : 01st February, 2020
 Place : Mumbai
 Monalisa Digant Parikh - Chairperson / Managing Director
 DIN 00294485

CMI LIMITED
 CIN L74899DL1967PLC018031
 Regd. Office: Flat No. 501-503, 5th Floor, New Delhi House
 27 Barakhamba Road, New Delhi - 110 001
 Ph.: 011-49570000, Fax No.: 011-23739902
 Website: www.cmilimited.in Email: info@cmilimited.in

NOTICE OF BOARD MEETING

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Thursday, 13th February, 2020, to inter alia, consider and approve the Un-audited Financial Results for the quarter and nine months ended on 31st December, 2019.

The said notice may be accessed on the Company's website at www.cmilimited.in and may also be accessed on the Stock Exchange website at www.bseindia.com and www.nseindia.com.

Further, pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 as amended by SEBI (Prohibition of Insider Trading) (Amendment) Regulations, 2018 and in accordance with the Code of conduct to Regulate, Monitor and Report Trading by Insiders, the "Trading Window" which has been closed from 01st January, 2020 shall remain closed till 15th February, 2020 i.e. 48 hours after the announcement by the Company of the results to the stock exchanges on 13th February, 2020.

For CMI Limited
 Subodh Kr. Barnwal
 (Company Secretary)
 Date: 05.02.2020
 Place: New Delhi

સનકેર ટ્રેડર્સ લિમિટેડ
 CIN: L51909GJ1997PLC031561
 રજીસ્ટર્ડ ઓફિસ : ૭, શ્રી શક્તિ એસ્ટેટ, વિલાન સંકુલની પાછળ, સરખેજ-સાણંદ ક્રોસ રોડ, સરખેજ, અમદાવાદ-૩૮૨૨૧૦.
 Tel: +91-079-29096047, Website: www.sct.in
 Email: sct31561@gmail.com

નોટીસ

આથી નોટિસ આપવામાં આવે છે કે નિયમ ૨૯ સાથે સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) નિયમ-૨૦૧૫ના નિયમ ૪૭ સાથે વાંચતા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ ગુરુવાર ફેબ્રુઆરી ૧૩, ૨૦૨૦ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ, ૭, શ્રી શક્તિ એસ્ટેટ, વિલાન કોમ્પ્લેક્સ પાછળ, સરખેજ-સાણંદ ક્રોસ રોડ, સરખેજ, અમદાવાદ-૩૮૨૨૧૦ ખાતે આંતર બાબતોની સાથે સાથે ડિસેમ્બર ૩૧, ૨૦૧૯ના રોજ પુરા થયેલા કંપનીના અર્થવાર્ષિક અને અનઓડિટેડ (સ્ટેન્ડ-એલોન) નાણાકીય પરિણામો સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) નિયમ ૨૦૧૫ના નિયમ ૩૩ પ્રમાણે સંજૂર કરવા ધ્યાનમાં લેવાશે.

વધુમાં ઈન્સાઈડર્સ દ્વારા કરવામાં આવતું ટ્રેડીંગને નિયંત્રિત કરવા દેખરેખ રાખવા અને તેનું રીપોર્ટ તૈયાર કરવા માટે કંપનીએ અપનાવેલ ધારાધોરણ જે સેબી (પ્રોહીબિશન ઓફ ઈન્સાઈડર ટ્રેડીંગ) રેગ્યુલેશન ૨૦૧૫નું પાલન કરવા તે પ્રમાણે કંપનીના સીક્યુરીટીના ડિલીવરી માટે ટ્રેડીંગ વિનું ખાસ કંપનીના માણસો માટે બંધ રહેશે અને ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ રવિવારના રોજ નાણાકીય પરિણામો જાહેર થયા બાદ અડતાલીસ (૪૮) કલાક પુરા થયા પછી ખુલશે.

સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) નિયમ ૨૦૧૫ના નિયમ ૪૭નું પાલન કરવા સારું ઉપર જણાવેલ નોટિસ કંપનીની વેબસાઈટ www.sct.in અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ જેમ કે BSE લિમિટેડ www.bseindia.com ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે.

સનકેર ટ્રેડર્સ લિમિટેડ વતી, સહી/-
 પૂજા શાહ
 કંપનીના સચિવ
 સ્થળ : અમદાવાદ
 તારીખ : ફેબ્રુઆરી ૫, ૨૦૨૦

GUJARAT GAS LIMITED
 (Formerly known as GSPC Distribution Networks Limited)
 Registered Office: Gujarat Gas CNG Station , Sector-5/C, Gandhinagar-382006, District: Gandhinagar, Gujarat.
 Tel: +91-79-26462980 Fax: + 91-79-26466249. Website: www.gujaratgas.com E-mail: rajeshwari.sharma@gujaratgas.com
 CIN: L40200GJ2012SGC069118

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2019

₹ in Crores

| Sr. No. | Particulars | Standalone | | | | Consolidated | | | | | |
|---------|---|---------------|--------------|-------------------|--------------|---------------|--------------|--------------|-------------------|--------------|--------------|
| | | Quarter ended | | Nine months ended | | Quarter ended | | | Nine months ended | | Year ended |
| | | 31-12-2019 | 31-12-2018 | 31-12-2019 | 31-12-2018 | 31-03-2019 | 31-12-2019 | 31-12-2018 | 31-12-2019 | 31-12-2018 | 31-03-2019 |
| | | Un-audited | | Audited | | Un-audited | | Audited | | | |
| 1 | Total income from operations | 2,582.85 | 2,187.28 | 7,869.10 | 6,091.85 | 8,073.76 | 2,582.90 | 2,187.36 | 7,869.29 | 6,092.06 | 8,074.04 |
| 2 | Net Profit for the period (before Tax, Exceptional items) | 263.20 | 215.36 | 884.74 | 460.88 | 611.72 | 263.25 | 215.44 | 884.93 | 461.09 | 612.00 |
| 3 | Net Profit for the period before Tax (after Exceptional items) | 263.20 | 197.49 | 884.74 | 443.01 | 593.85 | 263.25 | 197.57 | 884.93 | 443.22 | 594.13 |
| 4 | Net Profit for the period after Tax (after Exceptional items) | 196.54 | 138.03 | 947.48 | 300.49 | 417.03 | 197.30 | 138.74 | 948.37 | 301.86 | 418.45 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 196.73 | 136.81 | 943.02 | 301.51 | 414.97 | 197.49 | 137.51 | 943.89 | 302.87 | 416.36 |
| 6 | Equity Share Capital (Face value of ₹ 2/- each) | 137.68 | 137.68 | 137.68 | 137.68 | 137.68 | 137.68 | 137.68 | 137.68 | 137.68 | 137.68 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet) | | | | | 2,046.31 | | | | | 2,067.59 |
| 8 | Earnings Per Share in ₹ (Face Value of ₹ 2 each) (not annualised for Quarter) Basic (₹) Diluted (₹) | 2.86 2.86 | 2.01 2.01 | 13.76 13.76 | 4.37 4.37 | 6.06 6.06 | 2.87 2.87 | 2.02 2.02 | 13.78 13.78 | 4.38 4.38 | 6.08 6.08 |

Notes:

- The financial statements have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 and read together with the Companies (Indian Accounting Standards -Ind AS) Rules issued thereafter and other accounting principles generally accepted in India. These financial results are presented in accordance with the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended from time to time along with other relevant rules issued thereunder.
- The above is an extract of the detailed format of quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 (as amended). The full format of the same is available on the Stock Exchange websites. (www.nseindia.com and www.bseindia.com) and also on Company's website www.gujaratgas.com.
- The above results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 5th February, 2020 at Gandhinagar, Gujarat.
- Previous period's figures have been reclassified/ regrouped/restated, wherever necessary.

Place: Gandhinagar
Date : 5th February, 2020

For and on behalf of Board of Directors
Gujarat Gas Limited
Dr. J. N. Singh, IAS (Retd.)
CHAIRMAN

adani ADANI GAS LIMITED
 Registered Office: "Adani House", Near Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad 380 009 | Phone : 079-26565555 | Fax : 079-26565500
 Email : info@adani.com | Website : www.adanigas.com
 (CIN: L40100GJ2005PLC046553)

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2019

₹ in Crores

| Sr. No. | Particulars | Consolidated | | |
|---------|--|--------------------------|------------------------------|--------------------------|
| | | Quarter Ended 31-12-2019 | Nine Months Ended 31-12-2019 | Quarter Ended 31-12-2018 |
| 1 | Total Income from operations | 529.10 | 1,533.24 | 496.52 |
| 2 | Net Profit for the period before tax (before exceptional item) | 143.62 | 391.30 | 91.11 |
| 3 | Net Profit for the period after tax (after exceptional items and share of profit from joint ventures and associates) | 115.54 | 314.91 | 47.21 |
| 4 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 115.27 | 314.11 | 47.45 |
| 5 | Equity Share Capital | 109.98 | 109.98 | 109.98 |
| 6 | Earnings Per Share (of ₹ 1/- each) - Basic & Diluted | 1.05 | 2.86 | 0.43 |

Notes :

- The above financial results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their meetings held on 5th February, 2020.
- Additional Information on standalone financial results is as follows:

₹ in Crores

| Sr. No. | Particulars | Standalone | | |
|---------|--|--------------------------|------------------------------|--------------------------|
| | | Quarter Ended 31-12-2019 | Nine Months Ended 31-12-2019 | Quarter Ended 31-12-2018 |
| 1 | Total Income from operations | 529.10 | 1,533.24 | 496.52 |
| 2 | Net Profit for the period before tax (before exceptional item) | 143.62 | 391.30 | 91.11 |
| 3 | Net Profit for the period after tax (after exceptional items) | 114.47 | 314.17 | 45.50 |
| 4 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 114.20 | 313.37 | 45.74 |

3 The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results for the quarter and nine months ended 31st December, 2019 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the quarter and nine months ended 31st December, 2019 are available on the Stock Exchange websites, www.bseindia.com and www.nseindia.com and on the Company's website, www.adanigas.com.

For & on Behalf of the Board
GAUTAM S. ADANI
Chairman
 Date : 5th February, 2020
 Place : Ahmedabad

adani Adani Enterprises Limited
 Registered Office: "Adani House", Near Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad 380 009 | Phone : 079-26565555 | Fax : 079-26565500
 Email : info@adani.com | Website : www.adanienterprises.com
 (CIN: L51100GJ1993PLC019067)

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2019

₹ in Crores

| Sr. No. | Particulars | Consolidated | | |
|---------|--|--------------------------|------------------------------|--------------------------|
| | | Quarter Ended 31-12-2019 | Nine Months Ended 31-12-2019 | Quarter Ended 31-12-2018 |
| 1 | Total Income from operations | 11,075.32 | 30,388.12 | 10,548.14 |
| 2 | Net Profit for the year (before exceptional items and tax) | 440.16 | 937.47 | 104.38 |
| 3 | Net Profit for the year before tax (after exceptional items) | 440.16 | 1,136.22 | 105.35 |
| 4 | Profit / (Loss) for the year | 382.98 | 943.06 | 80.09 |
| 5 | Total Comprehensive Income for the year [Comprising Profit / (Loss) for the year (after tax) and Other Comprehensive Income (after tax)] | 425.69 | 1,285.68 | (312.87) |
| 6 | Equity Share Capital | 109.98 | 109.98 | 109.98 |
| 7 | Earnings Per Share (of ₹ 1/- each) (not annualised) - Basic & Diluted | 3.88 | 9.79 | 0.84 |

Notes

- Additional Information on standalone financial results is as follows:

₹ in Crores

| Sr. No. | Particulars | Standalone | | |
|---------|--|--------------------------|------------------------------|--------------------------|
| | | Quarter Ended 31-12-2019 | Nine Months Ended 31-12-2019 | Quarter Ended 31-12-2018 |
| 1 | Total Income from operations | 3,906.91 | 12,472.72 | 4,620.91 |
| 2 | Net Profit for the year (before exceptional items and tax) | 314.51 | 767.29 | 195.27 |
| 3 | Net Profit for the year before tax (after exceptional items) | 314.51 | 1,082.63 | 195.27 |
| 4 | Profit / (Loss) for the year | 208.08 | 779.51 | 188.05 |
| 5 | Total Comprehensive Income for the year [Comprising Profit / (Loss) for the year (after tax) and Other Comprehensive Income (after tax)] | 207.79 | 778.64 | 187.62 |

2 The above financial results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their meetings held on 5th February 2020.

3 The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results for the quarter & nine months ended 31st December 2019 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the quarter & nine months ended 31st December 2019 are available on the Stock Exchange websites, www.bseindia.com and www.nseindia.com and on the Company's website, www.adanienterprises.com.

For & on Behalf of the Board
GAUTAM S. ADANI
Chairman
 Date : 5th February 2020
 Place : Ahmedabad